

ચેપી ગર્ભપાત

- પશુઓનો છૂપો શરૂ

ભારત એક ખેતીપ્રધાન દેશ છે. ખેતીની સાથે પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે છેલ્લા અમૃત વર્ષોથી ઉભરી આવેલ છે. આ પશુપાલનને નુકશાનકારક એક છૂપો રોગ કે જેનું નામ ચેપી ગર્ભપાત છે. ચેપી ગર્ભપાત હો મુખ્યત્વે ગાય, બેંસ, ઘેટાં, બકરા, ઘોડા તેમજ ભૂંડમાં થતો ચેપી રોગ છે. જેને અંગેજુમાં “બુસેલ્લોસિસ” તેમજ “બેંગ ડિસીગ” તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ રોગનો સર્વપ્રથમ પરિચય ઈ.સ. ૧૮૭૭માં ડેનમાર્કની અંદર બેંગ નામના વેફાનિકે કરાવ્યો હતો. આ રોગ ભારતના દરેક રાજ્યમાં ફેલાયેલો છે. આ રોગ લાગુ પડવાથી પશુની પ્રજનન શક્તિમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. જેથી ખેડૂતમિત્રોને આર્થિક રીતે ખૂબ જ નુકશાન થાય છે.

જીવાધુઓનો પરિચય :-

ચેપી ગર્ભપાત એ જીવાધુંજન્ય રોગ છે. જે “બુસેલ્લા એબોર્ટસ” નામના જીવાધુંથી ઉત્પન્ન થાય છે. આ જીવાધું નાના, લંબગોળ અને હલનચલન ના કરી શકે તેવા હોય છે. તે જમીનમાં ૫૦ દિવસ સુધી અને ગર્ભમાં ૧૮૨ દિવસ સુધી જીવીત રહી શકે છે.

રોગનો ફેલાવો કરતા પરિબળો :-

- આ રોગનો ફેલાવો બુસેલ્લા જીવાધું ચુક્ત ખોરાક તથા પાણીનો ઉપયોગ કરવાથી થાય છે.
- ગર્ભપાત થયેલ ગર્ભ તથા તેની સાથેના પ્રવાહીના સંપર્કમાં ખોરાક તથા પાણી આવે તો તે ચેપી બને છે, જે રોગ ફેલાવવા માટેનું અગત્યનું પરિબળ છે.
- ઈલરડી, ઉદર, કુતરા અને ચેપી આખલા દ્વારા મુખ્યત્વે આ રોગ ફેલાય શકે છે.
- બીજાન કર્મયારીઓની લેદરકારીને લીધે પણ ચેપી ગર્ભપાત થઈ શકે છે. રોગિએ જાનપરનું દૂધ પીવાથી તેના બચ્યામાં અને માણસોમાં પણ રોગ ફેલાય શકે છે.

રોગના લક્ષણો :-

- માદા જાનપરમાં ગર્ભધાન કાળના ૬ થી ૮ મહિના દરમિયાન ગર્ભપાત થવો તે આ રોગનું મુખ્ય લક્ષણ છે. તદ્વિપરાંત નીચે જણાવ્યા પ્રમાણેના લક્ષણો આ રોગમાં જોવા મળે છે.
- ચોનિ માંથી રસી નીકળતું
- આંચળમાં સોઝ આવવા
- ઓર રહી જવી
- જાનપરમાં આગળના પગના સાંઘામાં સોજો આવવો તથા પાણી ભરાઈ જવું.
- આખલામાં ઉતેજના ઓછી થઈ જવી.
- મનુષ્યમાં જો આ રોગનો ચેપ લાગે તો તેના હાથ પગના સાંઘામાં તથા શુક્કિંડમાં સોજો આવે છે.

રોગનું નિદાન :-

આ રોગનું નિદાન લેલોરેટરીમાં જીવાધુને અલગ તારવીને કરી શકાય છે.

જાનપરોના ઈતિહાસ જાણવાથી તથા તેનું દૂધ, લોહી કે પછી ચોનિમાગમાંથી થતા સ્ત્રાવનું લેલોરેટરીમાં જુદા જુદા ટેસ્ટ જેવા કે “રોગ ટેંગાલ ટેસ્ટ” અથવા “ઇલાર્ડ્ઝ ટેસ્ટ” દ્વારા થઈ શકે છે.

“મિલ્ક રીંગ ટેસ્ટ” દ્વારા દૂધ આપતા પશુઓના ટોળાનું નિદાન કરી શકાય છે.

“એનિટોલોવાઈન ગામા ગ્લોટ્યુલીન ટેસ્ટ” દ્વારા મનુષ્યમાં આ રોગનું નિદાન થઈ શકે છે.

સારવાર :-

આ રોગની સારવારમાં પેનીસીલીન, સ્ટ્રેટોમાઈસીન, ઓકસીટેટ્રાસાયક્લીન, ક્લોરટેટ્રાસાયક્લીન જેવી રોગની ચોન્ટીલાયોટીક્સ અમૃત અંશો સફળ થાય છે.

અટકાવવાના ઉપાયો :-

“Prevention is better than cure” રોગ થયા પછી સારવાર કરવા કરતા રોગને ઉગતો જ ડામયો આ સુવર્ણ સૂત્ર છે. અને તેથી જ આ રોગને અટકાવવા નીચે જણાવ્યા પ્રમાણેના પગાલાં ભરવા જોઈશે.

- રોગનું નિરાન થતા રોગિએ પશુને બીજા પશુઓથી અલગ રાખવું.
- પડી ગયેલ ગર્ભ, પેશાં, ઓર તેમજ યોનિમાર્ગમાંથી થતા સ્ત્રાવનો યોગ્ય નિકાલ કરવો જેથી કરીને બીજા પશુઓના સંપર્ક માં ના આવે.
- નવા ખરીદારેલા પશુઓમાંથા રોગનું પરિક્ષણ કરવું.
- ઠ થી ૮ મહિના વચ્ચેની ઉંમરના માદા પશુઓમાં આ રોગની રસી “લુસેલ્લા સ્ટ્રેઇન ૧૬” મુક્કાવવી જોઈએ.
- ગર્ભ ઘારણ કરેલ પશુમાં આ રોગની રસી ના મુક્કવી કારણ કે ગર્ભપાત થવાની શક્યતા રહે છે.



અધુરા માસે ગર્ભપાત



ઓર રહી જવી



પગના સાંદ્યામાં
સોજો આવવો



“લુસેલ્લા
સ્ટ્રેઇન ૧૬”
રસી

યોગી ગર્ભપાત

- પશુઓનો છૂપો શાળુ




MAHATMA AGRICULTURAL UNIVERSITY



150
YEARS OF
EXCELLENCE THE PRAIRIES



ICAR



ડૉ. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુવિજ્ઞાન)

ડૉ. ચો. જે. ટોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ)

ડૉ. સી. ડી. પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (ICAR)

નવરાત્રી કૃષિ યુનિવર્સિટી
ઓગ્સીકલ્યર પોલીટેકનિકની સામે,
ભેસકાગ્રી રોડ, પાનવાડી, વ્યારા, જિ.તાપી
ફોન નં. (૦૨૬૨૬) ૨૨૧૮૮૮
યુનિવર્સિટી પ્રકાશન નંબર : ૧૦૨/૨૦૨૦-૨૧